

To

**BSE Limited**

Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street, Fort,  
Mumbai- 400001

**BSE Scrip Code: 524202**

**Sub: Intimation under Regulation 47(3) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.**

Pursuant to Regulation 47(3) read with Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper cutting of Public Notice published in the Newspapers viz. — Business Standard (in English) and Vadodara Samachar (in Gujarati) on 15<sup>th</sup> August, 2023, in compliance with the Ministry of Corporate Affairs Circular dated 05<sup>th</sup> May, 2020, 13<sup>th</sup> January, 2021 and 05<sup>th</sup> May, 2022 intimating that the 32<sup>nd</sup> Annual General Meeting (AGM) of our Company scheduled to be held on Thursday, 07<sup>th</sup> September, 2023 at 12:00 noon (IST) will be held through electronic mode (Video Conferencing (“VC”) / Other Audio-Visual Means (“OAVM”).

Kindly take the same on record.

Thanking you,

**For Lactose (India) Limited**

**Ritesh Pandey**

**Company Secretary & Compliance Officer**

**Mem No.- A45942**

**Date: 16<sup>th</sup> August 2023**

**Place: Mumbai**

### LACTOSE (INDIA) LIMITED

CIN: L15201GJ1991PLC015186  
 Registered Office: Survey No 5,6 & 7A, Village Poicha (Rania), Taluka Savli, Vadodara, Gujarat 391780.  
 Corporate Office: G-2, A Wing, Navbharat Estate, Zakaria Bunder Road, Sewri (W), Mumbai 400015. Contact: 022-24117030 Fax: 022-24117034  
 Email: lil@lactoseindialimited.com, Website: www.lactoseindialimited.com

#### NOTICE FOR THE ATTENTION OF SHAREHOLDERS OF THE COMPANY NOTICE OF THE 32<sup>ND</sup> ANNUAL GENERAL MEETING

This is to inform that the 32<sup>nd</sup> Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on **Thursday, 07<sup>th</sup> September, 2023 at 12.00 noon IST** in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (SEBI Listing Regulations) and MCA Circular dated 05<sup>th</sup> May, 2022 read with circulars 08<sup>th</sup> April, 2020, 13<sup>th</sup> April, 2020 05<sup>th</sup> May, 2020, 28<sup>th</sup> September, 2020, 31<sup>st</sup> December, 2020 and 13<sup>th</sup> January, 2021 (MCA Circulars) to transact the business set out in the Notice to the AGM. The deemed venue for the 32<sup>nd</sup> AGM will be the registered office of the company.

The Notice convening the AGM along with the Annual Report for FY 2022-23 will be sent only through electronic mode on **Wednesday, 16<sup>th</sup> August, 2023** to the member's whose email address are registered with the Depository Participants ("DP's")/Company Registrar & Share transfer Agent viz Bigshare Service Private Limited ("RTA") in accordance with the MCA Circular and SEBI Regulations. Members holding shares in physical mode, who have not registered / updated their email addresses or mobile number with the Company, are requested to register/update the same by clicking on <https://bigshareonline.com/InvestorRegistration.aspx?AdvdTrack#> and members who have shares in dematerialized form and not yet registered their e-mail addresses are requested to register the same with their DPs.

Members can attend and participate in the AGM only through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"). The procedure or instructions for joining the AGM through VC/OAVM are stated in the notice.

The detailed procedure or instructions for casting votes through remote e-voting or e-voting during AGM for all Members (including the Members holding shares in physical form/ whose e-mail addresses are not registered with DP's/Company/RTA) are stated in the Notice.

This advertisement shall also be available on Company's website at [www.lactoseindialimited.com](http://www.lactoseindialimited.com) and also on BSE Limited website at [www.bseindia.com](http://www.bseindia.com)

**By Order of Board of Directors  
For Lactose (India) Limited  
Sd/-  
Ritesh Pandey  
Company Secretary**

Date : 14th August 2023  
Place : Mumbai

### DHATRE UDYOG LIMITED

(Formerly Known as Narayani Steels Limited)  
 Registered Office: ERGO TOWER, PLOT NO. - A1 - 4, BLOCK - EP & GP UNIT NO. - 1406, 14TH FLOOR, SECTOR - V BIDHAN NAGAR CK MARKET SALLAKE WB 700091 IN, PH- 033 48040592, +91 81007 19986, Email: info@dhatre.com/narayanisteelsvizag@gmail.com Website: www.narayanisteels.co.in

#### EXTRACT OF FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED 30<sup>TH</sup> JUNE 2023

(₹ in Lakhs)

Particulars	Standalone				Consolidated			
	Quarter ended		Year ended		Quarter ended		Year ended	
	30th June 2023 (Unaudited)	31st March 2023 (Audited)	31st March 2023 (Unaudited)	31st March 2023 (Audited)	30th June 2023 (Unaudited)	31st March 2023 (Audited)	31st March 2023 (Unaudited)	31st March 2023 (Audited)
Total Income from Operations	4121.05	511.94	4,766.17	11,005.51	4121.05	511.94	4,766.17	11,005.51
Total Expenses	3844.69	331.21	4,359.83	10,079.33	3844.69	331.21	4,359.83	10,079.33
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	276.36	180.73	406.34	926.18	276.36	180.73	406.34	926.18
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	276.36	180.73	406.34	926.18	276.36	180.73	406.34	926.18
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	199.47	130.45	293.21	688.29	199.47	130.45	293.21	688.29
Total Comprehensive Profit / (Loss) net of tax	0.04	(0.03)	(1.08)	(0.54)	0.04	(0.03)	(1.08)	(0.54)
Equity Share Capital	1089.55	54.55	1,089.55	1,089.55	1089.55	54.55	1,089.55	1,089.55
Other Equity (excluding Revaluation Reserve)	-	5,036.70	-	5,014.69	-	5,036.70	-	5,014.69
Earnings Per Share (EPS) (not annualised)	1.83	23.92	2.68	11.54	1.83	23.92	2.68	11.54
1. Basic (in Rs.)	1.83	23.92	2.68	11.54	1.83	23.92	2.68	11.54
2. Diluted (in Rs.)	1.83	1.20	2.68	6.13	1.83	1.20	2.68	6.13

Note:  
 1. The above is an extract of the detailed format of Un-audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website viz. [www.narayanisteels.co.in](http://www.narayanisteels.co.in) and on the website of BSE ([www.bseindia.com](http://www.bseindia.com))

**For Dhatre Udyog Limited  
(Formerly known as Narayani Steels Limited)  
Sd/-  
Ankita Dutta  
Company Secretary & Compliance Officer**

Place: Kolkata  
Date: August 14, 2023

### OLYMPIC OIL INDUSTRIES LTD

CIN :L15141MH1980PLC022912  
 Regd. Office : 709, C Wing, One BKC, Near Indian Oil Petrol Pump, G Block, BKC, Bandra (East), Mumbai - 400051  
 Email : olympicoiltltd@gmail.com Website : www.olympicoil.co.in Tel : 022-6249 4444 Fax : 02226520906

#### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

(₹ in Lacs except EPS)

Particulars	Quarter ended		
	30.06.2023 (Un-Audited)	Year ended on 31.03.2023 (Audited)	Quarter Ended 30.06.2022 (Un-Audited)
	Total Income from operations (net)	-	2.12
Net Profit / (Loss) from ordinary activities after tax	(12.87)	(46.88)	(14.08)
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	(12.87)	(47.22)	(14.08)
Equity Share Capital	285.40	285.40	285.40
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	(2,476.56)	-
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)	(0.45)	(1.65)	(0.49)
Basic:	(0.45)	(1.65)	(0.49)
Diluted:	(0.45)	(1.65)	(0.49)
Earnings Per Share (After extraordinary items) (of Rs. 10/- each)	(0.45)	(1.65)	(0.49)
Basic:	(0.45)	(1.65)	(0.49)
Diluted:	(0.45)	(1.65)	(0.49)

Note: The above is an extract of the detailed format of Quarterly and Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and on website of the Company at [www.olympicoil.co.in](http://www.olympicoil.co.in).

**For Olympic Oil Industries Limited  
Nipun Verma  
Whole-time Director  
DIN: 02923423**

Place : Mumbai  
Date: 14<sup>th</sup> August, 2023

### KAMARAJAR PORT LIMITED

CIN:U45203TN1999PLC043322  
 (A Company of Chennai Port Authority)  
 (Ministry of Ports, Shipping and Waterways - Government of India)  
 Registered Office : 2<sup>nd</sup> Floor (North wing) & 3<sup>rd</sup> Floor, Jawahar building, 17, Rajaji Salai, Chennai - 600 001  
 Tel: +91 (44) 2525 1666; Fax: +91 (44) 2525 1665; Website: www.kamarajarport.in

### STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30<sup>TH</sup> JUNE 2023

Regulation 52(8) read with Regulation 52(4) of the SEBI (LODR) Regulations, 2015 (as amended)

S. No.	Particulars	Quarter ended		Year ended	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
		Unaudited		Audited	
(Rupees in lakhs)					
1	Total Income including Revenue from Operations	25761.22	24809.54	23772.83	100922.50
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	16972.23	17803.73	14878.01	72426.87
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	16972.23	3115.36	14878.01	57738.50
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	10971.91	2001.50	9776.21	37350.22
5	Total Comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	10975.53	1933.94	9776.21	37287.40
6	Paid up Equity Share Capital	30000.00	30000.00	30000.00	30000.00
7	Reserves (excluding Revaluation Reserve)	246613.48	235637.95	235134.55	235637.95
8	Securities Premium Account	-	-	-	-
9	Net Worth	276613.48	265637.95	265134.55	265637.95
10	Paid up Debt Capital / Outstanding Debt	37622.01	37619.28	45897.85	37619.28
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-
12	Debt Equity Ratio	0.21	0.22	0.26	0.22
13	Earnings per Share (Rs.10/- each) (for continuing and discontinued operations) # - Basic & Diluted - in Rs.	3.66	0.64	3.26	12.43
14	Capital Redemption Reserve	-	-	-	-
15	Debt Redemption Reserve	6689.69	6575.47	8157.13	6575.47
16	Debt Service Coverage Ratio	2.86	0.40	1.02	2.91
17	Interest Coverage ratio	11.25	13.24	10.78	13.34

# Not annualised

Notes:  
 1 The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchange ([www.bseindia.com](http://www.bseindia.com)) and the listed entity (www.kamarajarport.in).  
 2 The above results of the Company have been prepared as per SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 (as amended) and have been reviewed and recommended by the Audit Committee on 14.08.2023 and Board of Directors have approved in their meeting held on the same day.  
 3 For the other line item referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on [www.bseindia.com](http://www.bseindia.com).  
 4 Previous year's figures have been regrouped and reclassified, wherever necessary, to make them comparable with current year figures.

**For and on behalf of the Board of Directors  
sd/-  
(SUNIL PALIWAL I.A.S)  
Chairman & Managing Director**

Place : Chennai  
Date : 14.08.2023

### GREENPLY INDUSTRIES LIMITED

Registered Office : Makum Road, P.O. Tinsukia, Assam - 786 125  
 Corporate Office: 'Madgul Lounge', 23 Chetla Central Road, 5th & 6th Floor, Kolkata - 700 027  
 Phone: (033) 3051 5000 Fax: (033) 3051 5010,  
 E-mail: Investors@greenply.com, Website: www.greenply.com  
 CIN: L20211AS1990PLC003484

#### NOTICE TO SHAREHOLDERS

INFORMATION REGARDING 33RD ANNUAL GENERAL MEETING OF GREENPLY INDUSTRIES LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCE/OTHER AUDIO VISUAL MEANS ("VC/OAVM")

Dear Member(s),

- Notice is hereby given that the 33rd Annual General Meeting (AGM) of Greenply Industries Limited (Company) is scheduled to be held on Wednesday, September 20, 2023, at 10:30 a.m. Indian Standard Time (IST) through Video Conferencing/Other Audio Visual Means (VC/OAVM) in compliance with all the applicable provisions of the Companies Act, 2013 (Act, 2013) and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs (MCA) General Circular Nos. 02/2022 dated May 05, 2022, 10/2022 and 11/2022 dated December 28, 2022 read with General Circular No. 20/2020, 14/2020 and 17/2020 dated May 05, 2020, April 08, 2020 and April 13, 2020 respectively and SEBI Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 read together with Circular Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and other applicable circulars, to transact the businesses as set out in the Notice of the 33rd AGM.
- In compliance with the above circulars and the applicable laws, electronic copies of the Notice of the 33rd AGM and the Annual Report for the Financial Year 2022-23 will be sent to all the shareholders, whose email addresses are registered with the Company/Company's Registrar and Share Transfer Agent/Depository Participants. The Notice of the 33rd AGM and the Annual Report will also be available on the Company's website at [www.greenply.com](http://www.greenply.com) and on the websites of the stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively.
- Shareholders holding shares in dematerialized mode, are requested to register/update their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode, who have not yet registered/updated their email addresses and mobile numbers with the Company are requested to furnish their email addresses and mobile numbers to the Company's Registrars and Share Transfer Agent, M/s. S. K. Infosolutions Pvt. Ltd., D/42, Katju Nagar Colony, Ground Floor, Near South City Mall, PO & PS - Jadavpur, Kolkata, West Bengal-700032, Phone: (033) 2412-0027/0029, Fax (033) 2412-0027, Email: [skcdilip@gmail.com](mailto:skcdilip@gmail.com), Website: [www.skinfo.com](http://www.skinfo.com).
- Shareholders whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e. September 13, 2023 will have an opportunity to cast their vote remotely and also during the meeting on the businesses as set out in the Notice of the 33rd AGM through electronic voting system. The manner of casting vote through remote e-voting or e-voting during the meeting by the shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice of the 33rd AGM.
- Pursuant to Section 91 of the Companies Act, 2013 read with regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR") the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Monday, August 21, 2023 to Thursday, August 24, 2023 (both days inclusive) for determining the name of Members eligible for dividend on equity shares, if declared at the AGM.
- In order to receive dividend/s in a timely manner, Members holding shares in physical form who have not updated their mandate for receiving the dividends directly in their bank accounts through Electronic Clearing Service or any other means ("Electronic Bank Mandate"), can register their Electronic Bank Mandate to receive dividends directly into their bank account electronically or any other means, by sending scanned copy of the following details/documents by email to [skcdivit@gmail.com](mailto:skcdivit@gmail.com), on urgent basis:
  - a signed request letter mentioning your name, folio number, complete address and following details relating to bank account in which the dividend is to be received:
    - Name and Branch of Bank and Bank Account type;
    - Bank Account Number allotted by your bank after implementation of Core Banking Solutions;
    - 11 digit IFSC Code;
  - self-attested scanned copy of cancelled cheque bearing the name of the Member or first holder, in case shares are held jointly;
  - self-attested scanned copy of the PAN Card; and
  - self-attested scanned copy of any document (such as AADHAAR Card, Driving Licence, Election Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company.

Members holding shares in demat form, please update your Electronic Bank Mandate through your Depository Participant/s.

**For Greenply Industries Limited  
Sd/-  
Kaushal Kumar Agarwal  
Company Secretary & Vice President-Legal**

Dated: 14.08.2023  
Place: Kolkata

### IFB AGRO INDUSTRIES LIMITED

Regd. Office: Plot No.IND-5, Sector-I, East Kolkata Township, Kolkata 700107  
 E-mail : [complianceifbagro@ifbglobal.com](mailto:complianceifbagro@ifbglobal.com)  
 Website : [www.ifbagro.in](http://www.ifbagro.in), Ph : 033 3984 9652  
 CIN : L01409WB1982PLC034590

#### STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE THREE MONTHS ENDED 30 JUNE 2023

(Rs. in lakhs)

Sl. No.	Particulars	Three Months Ended			Year Ended
		30 June 2023	31 March 2023*	30 June 2022	31 March 2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Revenue from operations	33540	32569	40832	157084
2	Profit before tax	99	1618	1941	6779
3	Profit for the period	190	1016	1470	4913
4	Total comprehensive income for the period [Comprising profit for the period and other comprehensive income]	292	1106	1229	4721
5	Paid-up equity share capital (Face value Rs.10/- per share)	937	937	937	937
6	Earning per share (Face value of Rs. 10/- each) (not annualised) Basic & Diluted	2.03	10.85	15.69	52.45

Notes:  
 \* The figures for the quarter ended 31 March, 2023 are the balancing figures between audited figures in respect of full financial year and the year to date published figures upto the nine months ended 31 December, 2022, which were subjected to limited review.

The above is an extract of the detailed format of standalone unaudited three months and audited year ended financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the websites of the stock exchanges, [www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com) and also on the Company's website [www.ifbagro.in](http://www.ifbagro.in)

#### STATEMENT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE THREE MONTHS ENDED 30 JUNE 2023

(Rs. in lakhs)

Sl. No.	Particulars	Three Months Ended			Year Ended
		30 June 2023	31 March 2023*	30 June 2022	31 March 2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Revenue from operations	33426	32560	40825	157065
2	Profit/(Loss) before tax	(322)	1642	1986	6966
3	Profit/(Loss) for the period	(231)	1040	1515	5100
4	Total comprehensive income for the period [Comprising profit for the period and other comprehensive income]	(116)	1123	1282	4918
5	Paid-up equity share capital (Face value Rs. 10/- per share)	937	937	937	937
6	Earning per share (Face value of Rs.10/- each) (not annualised) Basic & Diluted	(2.47)	11.11	16.17	54.45

Notes:  
 \* The figures for the quarter ended 31 March, 2023 are the balancing figures between audited figures in respect of full financial year and the year to date published figures upto the nine months ended 31 December, 2022, which were subjected to limited review.

The above is an extract of the detailed format of standalone unaudited three months and audited year ended financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the websites of the stock exchanges, [www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com) and also on the Company's website [www.ifbagro.in](http://www.ifbagro.in)

**By order of the Board  
Amitabha Mukhopadhyay  
Managing Director and CEO  
DIN 01806781**

Place : Kolkata  
Date : August 14, 2023

### Indiabulls Commercial Credit Limited (CIN: U65923DL2006PLC150632)

Extract of Financial Results for the quarter ended June 30, 2023

(Rupees in Crores)

Sr.No.	Particulars	Quarter ended		
		30.06.23 (Unaudited)	31.03.23 (Audited)	30.06.22 (Unaudited)
		1. Total Income from Operations	248.22	1,886.35
2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	157.01	707.55	178.63	
3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	157.01	707.55	178.63	
4. Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	121.13	531.90	135.30	
5. Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	121.28	532.06	135.53	
6. Paid-up Equity Share Capital	-	247.80	-	
7. Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting year)	-	5,143.57	-	
8. Securities Premium Account	-	3,249.40	-	
9. Net worth	-	5,391.37	-	
10. Debt Capital / Outstanding Debt	-	7,202.52	-	
11. Outstanding Redeemable Preference Shares	-	-	-	
12. Debt Equity Ratio	-	1.34	-	
13. Earnings per Share (EPS) before extraordinary items (EPS for the quarters are not annualised)	-	-	-	
-Basic (Amount in Rs.)	4.89	21.46	5.46	
-Diluted (Amount in Rs.)	4.89	21.46	5.46	
-Face Value (Amount in Rs.)	10.00	10.00	10.00	
Earnings per Share (EPS) after extraordinary items (EPS for the quarters are not annualised)	-	-	-	
-Basic (Amount in Rs.)	4.89	21.46	5.46	
-Diluted (Amount in Rs.)	4.89	21.46	5.46	
-Face Value (Amount in Rs.)	10.00	10.00	10.00	
14. Capital Redemption Reserve (Rs. in Crores)	-	4.00	-	
15. Debenture Redemption Reserve (Rs. in Crores)	-	8.36	-	
16. Debt Service Coverage Ratio	-	-	-	
17. Interest Service Coverage Ratio	-	-	-	

Notes:  
 1. The above results have been reviewed by the Audit Committee on August 14, 2023 and subsequently approved at the meeting of the Board of Directors held on August 14, 2023.  
 2. This Audited financial results of the Company for the quarter and year ended March 31, 2023 has been prepared in accordance with the requirement of Regulation 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended from time to time.  
 3. The above is an extract of the detailed format of Quarter ended / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended / Annual Financial Results are available on the Company's website (<http://www.indiabullsccommercialcredit.com>) and on the website of BSE (<http://www.bseindia.com>) and NSE (<http://www.nseindia.com>).  
 4. Figures for the prior year / period have been regrouped and / or reclassified wherever considered necessary.

Registered Office: Building No. 27, 5<sup>th</sup> Floor, KG Marg, New Delhi-110001.

**For and on behalf of the Board of Directors  
Rajiv Gandhi  
Managing Director & CEO**

Place: Mumbai  
Date : August 14, 2023

### GARMENT MANTRA LIFESTYLE LIMITED

CIN: L18101TZ2011PLC017586  
 No.15, Murthys Plaza, Kariagounder Street, Khaderpet, Tirupur-641601.  
 E-Mail: [companysecretary@junctionfabrics.in](mailto:companysecretary@junctionfabrics.in) Tel No: +91-0421 2231896, +91-0421 2357140

#### Extract of unaudited financial results for the quarter ended 30<sup>th</sup> June, 2023

(Amount in Lak

